



નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય

## ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

કૃષિ હવામાનશાસ્ત્ર સેલ  
કૃષિ ઈજનેરી વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય  
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય  
નવસારી - ૩૮૬૪૫૦, ગુજરાત  
ઈ-મેઈલ:- [aasnavsari@gmail.com](mailto:aasnavsari@gmail.com)



ભારત મૌસમ વિજ્ઞાન  
વિભાગ

(નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય અને ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા પ્રસારિત)

**જારી કરવાની તારીખ: ૨૫/૦૭/૨૦૨૫**

**કૃષિ હવામાન બુલેટીન નં : ૩૪/૨૦૨૫ - ૨૦૨૬**

**-- નવસારી જિલ્લો --**

**પાછળનાં સમયનું હવામાન (તા. ૨૨ જુલાઈ થી ૨૫ જુલાઈ - ૨૦૨૫)**

| અનુ. નં.  | હવામાન પરિબલો                            | Value     |
|-----------|------------------------------------------|-----------|
| ૧.        | વરસાદની શ્રેણી (મી.મી.)                  | ૬.૦-૮૮.૦  |
| ૨.        | મહત્તમ તાપમાનની શ્રેણી (સે.ગ્રે.)        | ૨૬.૩-૩૧.૦ |
| ૩.        | લઘુત્તમ તાપમાનની શ્રેણી (સે.ગ્રે.)       | ૨૨.૦-૨૪.૦ |
| ૪.        | ભેજની શ્રેણી (%)                         | ૮૫-૧૦૦    |
| ૫.        | પવનની ગતિની શ્રેણી (કિ.મી./કલાક)         | ૪.૦-૪.૭   |
| ૬.        | વાદળની સ્થિતિની શ્રેણી (ઓકટા)            | ૬-૮       |
| ૭.        | સૂર્યપ્રકાશિત સમયની શ્રેણી (કલાક)        | ૦.૦-૩.૭   |
| ૮.        | પાછળના પાંચ દિવસમાં સંચિત વરસાદ (મી.મી.) | ૧૮૬.૦     |
| કુલ વરસાદ |                                          | ૮૩૮.૦     |

**આઈ. એમ. ડી. દ્વારા પ્રાપ્ત હવામાન આગાહી (તા. ૨૬ જુલાઈ થી ૩૦ જુલાઈ - ૨૦૨૫)**

| અનુ. નં. | હવામાન પરિબલો              | દિવસ-૧<br>(૨૬/૦૭) | દિવસ-૨<br>(૨૭/૦૭) | દિવસ-૩<br>(૨૮/૦૭) | દિવસ-૪<br>(૨૯/૦૭) | દિવસ-૫<br>(૩૦/૦૭) |
|----------|----------------------------|-------------------|-------------------|-------------------|-------------------|-------------------|
| ૧.       | વરસાદ (મી.મી.)             | ૮૦                | ૧૦૦               | ૧૧૩               | ૮૦                | ૬૦                |
| ૨.       | મહત્તમ તાપમાન (સે.ગ્રે.)   | ૩૧                | ૩૧                | ૩૦                | ૩૧                | ૩૧                |
| ૩.       | લઘુત્તમ તાપમાન (સે.ગ્રે.)  | ૨૬                | ૨૬                | ૨૭                | ૨૭                | ૨૭                |
| ૪.       | મહત્તમ ભેજ (%)             | ૮૫                | ૮૫                | ૮૫                | ૮૦                | ૮૦                |
| ૫.       | લઘુત્તમ ભેજ (%)            | ૮૫                | ૮૦                | ૮૦                | ૮૦                | ૮૦                |
| ૬.       | પવનની ગતિ (કિ.મી./કલાક)    | ૧૩                | ૧૭                | ૨૨                | ૨૫                | ૨૫                |
| ૭.       | પવનની દિશા (કમ્પાસ પોઈન્ટ) | ૨૨૬               | ૨૪૭               | ૨૪૮               | ૨૪૧               | ૨૪૩               |
| ૮.       | વાદળની સ્થિતિ (ઓકટા)       | ૮                 | ૮                 | ૮                 | ૮                 | ૮                 |

વિસ્તૃત શ્રેણીની આગાહી મુજબ, ૩૦ જુલાઈ, ૨૦૨૫ થી ૦૫ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી સામાન્યથી નીચે વરસાદ થવાની ધારણા છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની ધારણા છે.

|                                       |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       |
|---------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <b>હવામાન<br/>સારાંશ /<br/>ચેતવણી</b> | <ul style="list-style-type: none"> <li>આઈ. એમ. ડી., દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં આકાશમાં વાદળછાયું રહેશે અને છૂટાછવાયા જગ્યાઓમાં મધ્યમથી ભારે વરસાદ આવવાની સંભાવના છે.</li> <li>મહત્તમ તાપમાન ૩૦ સે. થી ૩૧ સે. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૬ સે. થી ૨૭ સે. આસપાસ હોવાની સંભાવના છે.</li> <li>હવામાં ભેજનું પ્રમાણ ૮૦ થી ૮૫ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે.</li> <li>પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૧૩ થી ૨૫ કિ.મી./કલાક રહેવાની શક્યતા છે.</li> </ul> |
|---------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|

## -:: દક્ષિણ ગુજરાત ભારે વરસાદ વિસ્તાર ::-


|                            |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |
|----------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <p><b>સામાન્ય સલાહ</b></p> | <ul style="list-style-type: none"> <li>જો પવનની ગતિ ૧૫ કિમી પ્રતિ કલાક કરતાં વધુ હોય તો ખેતરમાં કેમિકલ જેવકે પેસ્ટિસાઈડ નો છંટકાવ ન કરવો.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની કામગીરી થોડા દિવસ પુરતી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે, ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> <li>મછીમારોને સલાહ આપવામાં આવે છે કે અતિ ભારે વરસાદના સાએ દરિયાઈ વિસ્તારમાં પ્રવેશ ન કરવો.</li> <li>વધુ ઝડપી પવન સામે રક્ષણ માટે ઊભા બાગાયતી અને શાકભાજી પાકોની જાળવણી માટે લાકડાના અથવા વાંસ વડે યાંત્રિક ટેકા આપવો.</li> <li>ખુબ વીજળી અને વરસાદના સમયે પશુ વૃક્ષ નીચે બાંધવા નહિ.</li> <li>શેરડીના પાકમાં આજુબાજુના સાંઠાઓને બાંધી દેવા જેથી પવનની ઝડપ તેમજ વધુ વરસાદ સામે ટકી શકે.</li> <li>જો ખેતરમાં વધુ વરસાદી પાણી હોય, તો વધારાનું પાણી નીકળી ન જાય ત્યાં સુધી ડાંગરની રોપણી કરવાનું ટાળો.</li> </ul> <p>કૃષિ હવામાન સલાહકારી બુલેટીન અને હવામાનની આગાહી અંગેની માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો મેઘદૂત મોબાઈલ એપ્લિકેશન, જે ખેડુતોને તેમની સ્થાનિક ભાષામાં સ્થાન, પાક અને પશુધન વિશે હવામાનઆધારિત કૃષિ સલાહ પ્રદાન કરશે. મેઘદૂત એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:</p> <p>એન્ડ્રોઈડ યુઝર્સ: <a href="https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot">https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot</a></p> <p>આઈ.ઓ.એસ. યુઝર્સ: <a href="https://apps.apple.com/in/app/meghdoot/id1474048155">https://apps.apple.com/in/app/meghdoot/id1474048155</a></p> <ul style="list-style-type: none"> <li>દામિની મોબાઈલ એપ્લિકેશનદ્વારા આકાશીય વિજળીની અગાઉથી ચેતવણી આપવામાં આવે છે તેમજ આકાશીય વિજળીથી બચવા શું કરવું અને શું નહિ કરવું તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવે છે. આથી ખેડુતમિત્રોને દામિની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે. દામિની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો: એન્ડ્રોઈડ યુઝર્સ:</li> </ul> <p><a href="https://play.google.com/store/apps/details?id=com.lightening.live.damini">https://play.google.com/store/apps/details?id=com.lightening.live.damini</a></p> <p>આઈ.ઓ.એસ. યુઝર્સ: <a href="https://apps.apple.com/app/id1502385645">https://apps.apple.com/app/id1502385645</a></p> |
| <p><b>પાક</b></p>          | <p><b>હવામાન આધારિત કૃષિ સલાહ</b></p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           |
| <p><b>શેરડી</b></p>        | <ul style="list-style-type: none"> <li>ખેતરમાંથી વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દિવસ કામગીરી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> <li>શેરડીના પાકમાં આજુબાજુના સાંઠાઓને બાંધી દેવા જેથી પવનની ઝડપ તેમજ વધુ વરસાદ સામે ટકી શકે.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |
| <p><b>ચોમાસુ ડાંગર</b></p> | <ul style="list-style-type: none"> <li>ખેતરમાંથી વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દિવસ કામગીરી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> <li>જો ખેતરમાં વધુ વરસાદી પાણી હોય, તો વધારાનું પાણી નીકળી ન જાય ત્યાં સુધી ડાંગરની રોપણી કરવાનું ટાળો.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      |
| <p><b>ભીંડા</b></p>        | <ul style="list-style-type: none"> <li>ખેતરમાંથી વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દિવસ કામગીરી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| <p><b>પરવળ</b></p>         | <ul style="list-style-type: none"> <li>ખેતરમાંથી વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દિવસ કામગીરી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| <p><b>ટિંડોળા</b></p>      | <ul style="list-style-type: none"> <li>ખેતરમાંથી વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દિવસ કામગીરી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| <p><b>સુરણ</b></p>         | <ul style="list-style-type: none"> <li>ખેતરમાંથી વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દિવસ કામગીરી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| <p><b>રતાળુ</b></p>        | <ul style="list-style-type: none"> <li>ખેતરમાંથી વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દિવસ કામગીરી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| <p><b>તાનિયા</b></p>       | <ul style="list-style-type: none"> <li>ખેતરમાંથી વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |

|         |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    |
|---------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|         | <ul style="list-style-type: none"> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દીવસ કામગિરી મુલતવી રાખવી.</li> <li>ખેડુતોને ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             |
| આંબા    | <ul style="list-style-type: none"> <li>આંબાવાડીમાં વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> <li>આંબાનાં નાના રોપાની જાળવણી માટે યાંત્રિક ટેકો આપવાની વ્યવસ્થા કરવી જેથી વધુ પવનની ઝડપ સામે ટકી શકે.</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દીવસ કામગિરી મુલતવી રાખવી.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |
| ચીકુ    | <ul style="list-style-type: none"> <li>ચીકુવાડીમાં વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દીવસ કામગિરી મુલતવી રાખવી.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               |
| પશુપાલન | <p><b>સામાન્ય સલાહ :</b></p> <ul style="list-style-type: none"> <li>પશુઓનાં ઈતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથીન અથવા એમીટાઝર ૨ મી.લી./લિટર પાણીમાં નાખને છાંટવી (દવાની બોટલ ઉપર લખેલી સૂચનાનો અમલ કરવો).</li> <li>અતિ ભારે વરસાદના સમય પશુઓના રહેઠાણમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય તે પ્રમાણે કોઢ/ગમાણના ભોયાતળિયાનો ઢોળાવ અપાવો.</li> <li>કોઢ/ગમાણની ઉંચાઈ ૧૦ ફૂટથી વધારે રાખવી, જેથી હવાની હેરફેર સરળતાથી થઈ શકે, બફારો/ગરમી ઓછી થાય અને ભોયાતળિયાનો ભાગ સુકો રહે.</li> <li>સતત પુષ્કળ વરસાદમાં નાના વાછરડા-પાડીયા કે અન્ય પુખ્ત પશુ સતત લાંબા સમય સુધી ભીંજાય નહિ તે માટે તાડપત્રી/પતરાનો શેડ કે પાકી ગમાણ હેઠળ રાખવા.</li> <li>માખી મચ્છર થી રક્ષણ માટે પશુઓના રહેઠાણ ચોખ્ખાં રાખવા તેમજ પશુ રહેઠાણમાં ફીનાઈલ છાંટવું.</li> <li>ખુબ વીજળી અને વરસાદના સમયે પશુ વૃક્ષ નીચે બાંધવા નહિ.</li> </ul> |
| વનીકરણ  | <ul style="list-style-type: none"> <li>ખેતરમાં વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી</li> <li>દવા છંટકાવ અને ખાતર આપવાની થોડા દીવસ કામગિરી મુલતવી રાખવી.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| ફીશરીઝ  | <ul style="list-style-type: none"> <li>તળાવમાં પાણીનું લેવલ જાળવવું અને વધુ વરસાદ આવે ત્યારે તળાવના આઉટલેટ થોડી માત્રામાં ખોલવા તેથી પાણીનું લેવલ જાળવાયેલું રહે.</li> <li>તળાવમાં વરસાદનું વધારાના પાણીના નિકાલ કરવી.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  |

❖ એગ્રોમેટ સલાહકાર સેવા બુલેટીન કમિટીના સભ્યો :

- ડૉ. એચ. એમ. વિરડીયા, પ્રાધ્યાપક અને વડા (સશ્ય વિજ્ઞાન)
- ડૉ. જી. જી. પરતાગીયા, પ્રાધ્યાપક અને વડા (વનસ્પતિ કીટકશાસ્ત્ર)
- ડૉ. કે. બી. રાખોલીયા, સહ પ્રાધ્યાપક (વનસ્પતિ રોગશાસ્ત્ર) :
- ડૉ. સી. જી. ઈટવાલા, સંશોધન વૈજ્ઞાનિક (શાકભાજી વિજ્ઞાન)
- ડૉ. વાય. એન. ટેડલ, પ્રાધ્યાપક (ફળ વિજ્ઞાન)
- ડૉ. વી. આર. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક (પશુપાલન)
- ડૉ. એમ. બી. ટેડલ, મદદનીશ પ્રાધ્યાપક અને વડા (વનીકરણ)
- ડૉ. એમ. આર. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક (ફીશરીઝ સાયન્સ)
- ડૉ. વિભા ટાક, રીસર્ચ એસોસિયેટ (જી.કે.એમ.એસ.)
- ડૉ. પી. કે. પરમાર, મદદનીશ પ્રાધ્યાપક (કૃષિ હવામાનશાસ્ત્ર) અને પ્રિન્સિપાલ નોડલ ઓફિસર (જી.કે.એમ.એસ.)

NOAA/VIIRS/BLENDED NDVI Composite ending on Week no 28  
(09.07.2025 to 15.07.2025) over Agricultural region  
Gujarat



Agriculture vigour is moderate at isolated places of the state.

Source: <https://www.star.nesdis.noaa.gov>



# Gramin Krishi Mausam Sewa

Agricultural Meteorological Cell  
Department of Agricultural Engineering  
N. M. College of Agriculture  
Navsari Agricultural University  
Navsari – 396450, Gujarat  
E-mail :- aasnavsari@gmail.com



(Jointly issued by Navsari Agricultural University & India Meteorological Department)

**DATE OF ISSUE: 25/07/2025**

**Agromet Advisory Bulletin No: 34/2025 - 2026**

**-- Navsari District --**

**Weather summary of preceding week (22 July to 25 July - 2025)**

| Sr. No.                    | Name of Weather Parameters              | Value        |
|----------------------------|-----------------------------------------|--------------|
| 1.                         | Range of Rainfall (mm)                  | 6.0-98.0     |
| 2.                         | Range of Maximum Temperature (°C)       | 29.3-31.0    |
| 3.                         | Range of Minimum Temperature (°C)       | 22.0-24.0    |
| 4.                         | Range of Relative Humidity (%)          | 85-100       |
| 5.                         | Range of Wind Speed (km/hrs)            | 4.0-4.7      |
| 6.                         | Range of Cloud Cover (Okta)             | 6-8          |
| 7.                         | Range of bright sunshine hours (hrs)    | 0.0-3.7      |
| 8.                         | Last five days cumulative rainfall (mm) | 189.0        |
| <b>Total Rainfall (mm)</b> |                                         | <b>838.0</b> |

**IMD based Weather forecast for (26 July to 30 July - 2025)**

| Sr. No. | Weathers Parameters            | Day - 1<br>(26/07) | Day - 2<br>(27/07) | Day - 3<br>(28/07) | Day - 4<br>(29/07) | Day - 5<br>(30/07) |
|---------|--------------------------------|--------------------|--------------------|--------------------|--------------------|--------------------|
| 1.      | Rainfall (mm)                  | 90                 | 100                | 113                | 80                 | 60                 |
| 2.      | Maximum temperature (°C)       | 31                 | 31                 | 30                 | 31                 | 31                 |
| 3.      | Minimum Temperature (°C)       | 26                 | 26                 | 27                 | 27                 | 27                 |
| 4.      | Max. Relative Humidity (%)     | 95                 | 95                 | 95                 | 90                 | 90                 |
| 5.      | Min. Relative Humidity (%)     | 95                 | 90                 | 90                 | 90                 | 90                 |
| 6.      | Wind Speed (km/hr.)            | 13                 | 17                 | 22                 | 25                 | 25                 |
| 7.      | Wind Direction (Compass point) | 226                | 247                | 249                | 241                | 243                |
| 8.      | Total Cloud Cover (Okta)       | 8                  | 8                  | 8                  | 8                  | 8                  |

**According to the extended range forecast, below normal rainfall is expected and maximum and minimum temperatures are expected to be normal till 30<sup>th</sup> July, 2025 to 05<sup>th</sup> August, 2025.**

## Weather Summary/ Alert

- As per the forecast issued by India Meteorological Department over the next five days, the sky will be cloudy and there are chances of moderate to heavy rainfall at isolated places.
- The Maximum temperature is 30 °C to 31 °C, when the Minimum temperature is 26 °C to 27 °C likely to be around.
- The humidity in the air is likely to be between 90 and 95 percent.
- The wind direction will be South-West with an average speed of 13 to


## -:: South Gujarat Heavy Rainfall Zone ::-

| <b>General Advisory</b>  | <ul style="list-style-type: none"> <li>• Wind speed is high &gt;15 kmph, so avoid spraying of pesticide.</li> <li>• Provide mechanical support to horticultural and vegetable crops during forecasts of high wind velocity.</li> <li>• Farmers are advised to drain excess rainwater from standing crop fields.</li> <li>• Farmers are advised to postpone spraying chemicals and applying fertilizers.</li> <li>• Farmers are advised to postpone various farm operations.</li> <li>• Fishermen are advised not to venture into the sea during heavy rainfall.</li> <li>• Do not keep animals under trees during heavy lightning and rain.</li> <li>• Prop the sugarcane canes with strong bamboos or tie the canes together in a clump with sugarcane leaves to protect against wind and heavy rain.</li> <li>• If there is excess rain water in the field, avoid transplanting paddy until the excess water is drained.</li> </ul> <p>Download the MEGHDOOT mobile application for Agromet Advisory Services and information on weather forecasting, which will provide weather based agricultural advice to farmers for their location, crops and livestock in their local language. Click on the following link to download the MEGHDOOT application:</p> <p>Android users:<br/> <a href="https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot">https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot</a><br/>         IOS users: <a href="https://apps.apple.com/in/app/meghdoot/id1474048155">https://apps.apple.com/in/app/meghdoot/id1474048155</a></p> <p>Download the DAMINI Mobile application to ensure the safety through monitoring sky lightning activity. It will provide the alert and detail description of instruction, precaution, Do and Don't. Click on the following link to download the DAMINI application.</p> <p>Android users:<br/> <a href="https://play.google.com/store/apps/details?id=com.lighteninglive.damini">https://play.google.com/store/apps/details?id=com.lighteninglive.damini</a><br/>         IOS users: <a href="https://apps.apple.com/app/id1502385645">https://apps.apple.com/app/id1502385645</a></p> |
|--------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <b>Crop</b>              | <b>Weather based Agro-Advisory</b>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          |
| <b>Sugarcane</b>         | <ul style="list-style-type: none"> <li>• Drain out excess rain water from standing crop field.</li> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Postponed the different activities of farm operations.</li> <li>• Prop the sugarcane canes with strong bamboos or tie the canes together in a clump with sugarcane leaves to protect against wind and heavy rain.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| <b>Khari Paddy</b>       | <ul style="list-style-type: none"> <li>• Drain out excess rain water from paddy field.</li> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Postponed the different activities of farm operations.</li> <li>• If there is excess rainwater in the field, avoid transplanting paddy until the excess water is drained.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   |
| <b>Khari Okra</b>        | <ul style="list-style-type: none"> <li>• Drain out excess rain water from standing crop field.</li> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Postponed the different activities of farm operations.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |
| <b>Pointed gourd</b>     | <ul style="list-style-type: none"> <li>• Drain out excess rain water from standing crop field.</li> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Postponed the different activities of farm operations.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |
| <b>Little gourd</b>      | <ul style="list-style-type: none"> <li>• Drain out excess rain water from standing crop field.</li> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Postponed the different activities of farm operations.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |
| <b>Elephant foot yam</b> | <ul style="list-style-type: none"> <li>• Drain out excess rain water from standing crop field.</li> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Postponed the different activities of farm operations.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |
| <b>Greater yam</b>       | <ul style="list-style-type: none"> <li>• Drain out excess rain water from standing crop field.</li> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Postponed the different activities of farm operations.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |
| <b>Tannia</b>            | <ul style="list-style-type: none"> <li>• Drain out excess rain water from standing crop field.</li> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Postponed the different activities of farm operations.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |
| <b>Mango</b>             | <ul style="list-style-type: none"> <li>• Postponed spraying chemical and fertilizer application.</li> <li>• Provide mechanical support to young mango plant.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     |

|                  |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |
|------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
|                  | <ul style="list-style-type: none"> <li>Postponed the different activities of farm operations.</li> <li>Drain out excess rain water from mango orchard.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            |
| <b>Sapota</b>    | <ul style="list-style-type: none"> <li>Postponed spraying chemical and fertilizer application.</li> <li>Postponed the different activities of farm operations.</li> <li>Drain out excess rain water from sapota orchard.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          |
| <b>Livestock</b> | <ul style="list-style-type: none"> <li>For the control of tick and other parasites, spray Deltamethrin or Aemita 2 ml in 1 liter of water.</li> <li>During heavy rainfall, give sufficient slop on the floor of animal shed to avoid water logging.</li> <li>Height of animal shed should keep minimum 10 feet for aeration to maintain the floor dry and to control humidity.</li> <li>Don't keep the animal under tree when there is heavy lightning during rain.</li> <li>Spray phenyl in the animal shed to avoid flies and mosquitoes.</li> <li>To protect the animals from electric current when it is raining, keep away from appliances like poles, power boxes and broken wires where the current is on.</li> </ul> |
| <b>Forestry</b>  | <ul style="list-style-type: none"> <li>Postponed spraying chemical and fertilizer application.</li> <li>Postponed the different activities of farm operations.</li> <li>Drain out excess rain water.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |
| <b>Fisheries</b> | <ul style="list-style-type: none"> <li>Increase water depth and maintain water level through pond outlet.</li> <li>Drain out excess rain water from fish pond.</li> </ul>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    |

❖ **Members of Agro-Advisory Committee :**

- Dr. H. M. Viradia, Professor & Head (Agronomy)
- Dr. J. J. Pastagia, Professor & Head (Entomology)
- Dr. K. B. Rakholiya, Associate Professor (Plant Pathology):
- Dr. C. G. Intwala, Research Scientist (Vegetable Science)
- Dr. Y. N. Tandel, Professor (Fruit Science)
- Dr. V. R. Patel, Assistant Professor (Animal Husbandry)
- Dr. M. B. Tandel, Assistant Professor (Forestry) & I/C Head (SAF) (Forestry)
- Dr. M. R. Patel, Assistant Professor (Fisheries Science)
- Dr. Vibha Tak, Research Associate (GKMS)
- Dr. P. K. Parmar, Assistant Professor (Agricultural Meteorology and Principal Nodal Officer (GKMS))



Source: <https://www.star.nesdis.noaa.gov>

# હવામાન આગાહી

| વિગત                       | તારીખ      | ડાંગ | નવસારી | વલસાડ |
|----------------------------|------------|------|--------|-------|
| વરસાદની શ્રેણી (મી.મી.)    | ૨૬/૦૭/૨૦૨૫ | ૭૨   | ૯૦     | ૧૧૨   |
|                            | ૨૭/૦૭/૨૦૨૫ | ૯૦   | ૧૦૦    | ૧૧૨   |
|                            | ૨૮/૦૭/૨૦૨૫ | ૯૫   | ૧૧૩    | ૧૧૫   |
|                            | ૨૯/૦૭/૨૦૨૫ | ૭૦   | ૮૦     | ૯૦    |
|                            | ૩૦/૦૭/૨૦૨૫ | ૬૦   | ૬૦     | ૭૦    |
| મહત્તમ તાપમાન (સે.ગ્રે.)   | ૨૬/૦૭/૨૦૨૫ | ૨૭   | ૩૧     | ૩૧    |
|                            | ૨૭/૦૭/૨૦૨૫ | ૨૮   | ૩૧     | ૩૧    |
|                            | ૨૮/૦૭/૨૦૨૫ | ૨૭   | ૩૦     | ૩૦    |
|                            | ૨૯/૦૭/૨૦૨૫ | ૨૮   | ૩૧     | ૩૧    |
|                            | ૩૦/૦૭/૨૦૨૫ | ૨૮   | ૩૧     | ૩૧    |
| લઘુત્તમ તાપમાન (સે.ગ્રે.)  | ૨૬/૦૭/૨૦૨૫ | ૨૫   | ૨૬     | ૨૬    |
|                            | ૨૭/૦૭/૨૦૨૫ | ૨૫   | ૨૬     | ૨૬    |
|                            | ૨૮/૦૭/૨૦૨૫ | ૨૫   | ૨૭     | ૨૭    |
|                            | ૨૯/૦૭/૨૦૨૫ | ૨૫   | ૨૭     | ૨૭    |
|                            | ૩૦/૦૭/૨૦૨૫ | ૨૫   | ૨૭     | ૨૭    |
| મહત્તમ ભેજ (%)             | ૨૬/૦૭/૨૦૨૫ | ૧૦૦  | ૯૫     | ૯૫    |
|                            | ૨૭/૦૭/૨૦૨૫ | ૧૦૦  | ૯૫     | ૯૫    |
|                            | ૨૮/૦૭/૨૦૨૫ | ૧૦૦  | ૯૫     | ૯૫    |
|                            | ૨૯/૦૭/૨૦૨૫ | ૧૦૦  | ૯૦     | ૯૦    |
|                            | ૩૦/૦૭/૨૦૨૫ | ૯૫   | ૯૦     | ૯૦    |
| લઘુત્તમ ભેજ (%)            | ૨૬/૦૭/૨૦૨૫ | ૮૫   | ૯૫     | ૯૫    |
|                            | ૨૭/૦૭/૨૦૨૫ | ૯૦   | ૯૦     | ૯૦    |
|                            | ૨૮/૦૭/૨૦૨૫ | ૯૦   | ૯૦     | ૯૦    |
|                            | ૨૯/૦૭/૨૦૨૫ | ૯૦   | ૯૦     | ૯૦    |
|                            | ૩૦/૦૭/૨૦૨૫ | ૯૦   | ૯૦     | ૯૦    |
| પવનની ગતિ(કિ.મી./કલાક)     | ૨૬/૦૭/૨૦૨૫ | ૯    | ૧૩     | ૧૨    |
|                            | ૨૭/૦૭/૨૦૨૫ | ૧૩   | ૧૭     | ૧૬    |
|                            | ૨૮/૦૭/૨૦૨૫ | ૧૬   | ૨૨     | ૨૦    |
|                            | ૨૯/૦૭/૨૦૨૫ | ૧૮   | ૨૫     | ૨૧    |
|                            | ૩૦/૦૭/૨૦૨૫ | ૧૮   | ૨૫     | ૨૧    |
| પવનની દિશા (કમ્પાસ પોઈન્ટ) | ૨૬/૦૭/૨૦૨૫ | SW   | SW     | SW    |
|                            | ૨૭/૦૭/૨૦૨૫ | SW   | SW     | SW    |
|                            | ૨૮/૦૭/૨૦૨૫ | SW   | W      | SW    |
|                            | ૨૯/૦૭/૨૦૨૫ | SW   | SW     | SW    |
|                            | ૩૦/૦૭/૨૦૨૫ | SW   | SW     | SW    |
| વાદળની સ્થિતિ (ઓકટા)       | ૨૬/૦૭/૨૦૨૫ | ૮    | ૮      | ૮     |
|                            | ૨૭/૦૭/૨૦૨૫ | ૮    | ૮      | ૮     |
|                            | ૨૮/૦૭/૨૦૨૫ | ૮    | ૮      | ૮     |
|                            | ૨૯/૦૭/૨૦૨૫ | ૮    | ૮      | ૮     |
|                            | ૩૦/૦૭/૨૦૨૫ | ૮    | ૮      | ૮     |